

ત્વરિત જાહેરાત માટે

ડાઉનટાઉન બ્રેમ્પટનમાં આગમન થાય છે થોડા જ સમયમાં

ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેસ વધુ પહોળા કુટપાથ ઉન્નત જાહેર સ્થળો.

બ્રેમ્પટન, ઓન્ટારિયો (03 ફેબ્રુઆરી 2022) – ડાઉનટાઉન બ્રેમ્પટન પરિવર્તિત થઈ રહ્યું છે, આ મહિનાની શરૂઆતથી રિજન ઓફ પીલ આ વિસ્તારમાં પાણીની મેઈન લાઈન અને ગટરો બદલવા માટેનું બાંધકામ હાથ ધરશે જેના પછી સિટી પોતાનું કાર્ય શરૂ કરશે જેમાં કુટપાથ બદલવા તથા પહોળા કરવા અને માર્ગોને રિસર્ફેસ કરવા તેમજ તેનું સમારકામ કરવાનો સમાવેશ થાય છે.

બાંધકામની શરૂઆત જાન્યુઆરીના અંતભાગમાં શરૂ થશે અને અપેક્ષા રાખવામાં આવે છે કે 2025 સુધીમાં પૂર્ણ થશે જો COVID-19 ની મહામારીને ધ્યાન પર લઈએ અને હવામાન સાથે આપે તો. રિજન ઓફ પીલે બાંધકામની તબક્કાવાર યોજનાઓ જાહેર કરી છે. રહેવાસીઓ અને વ્યવસાયો માહિતીની સમીક્ષા અહીં કરીને પ્રશ્નો અને ટિપ્પણીઓ રજૂ કરી શકશે.

કિવન સ્ટ્રીટના બાંધકામ દરમિયાન યાતાયાતની એક લેન પ્રત્યેક દિશામાં જાળવી રાખવામાં આવશે. મેઈન સ્ટ્રીટના બાંધકામ દરમિયાન યાતાયાતની એક દિશાને એક જ દિશામાં જાળવી રખાશે. તમામ વ્યવસાયો પર રાહદારીઓની પહોંચ સામાન્યતઃ જાળવાશે અને કુટપાથ ખુલ્લી રહેશે. બૂલવાર્ડોની અંદર કેટલાક ટૂંકા ગાળાના કાર્યો કરાશે જેના પછી કર્બ અને કુટપાથો સંપૂર્ણપણે બદલવામાં આવશે અને તે વખતે રાહદારીઓને સ્ટ્રીટની બીજી બાજુએ નિર્દેશિત કરવામાં આવશે.

આ ઉન્નતિકરણો સિટીના ઈન્ટિગ્રેટેડ ડાઉનટાઉન પ્લાનને આગળ ધપાવવાનો ચાવીરૂપ ભાગ છે જે ડાઉનટાઉન બ્રેમ્પટનના અનેક ચાલુ રહેલ પહેલો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પરિયોજનાઓનું માર્ગદર્શન કરશે જેથી વિકાસ અને નિવેશન પ્રોત્સાહન મળશે.

વધુ જાણકારી માટે www.brampton.caની મુલાકાત લો..

ડાઉનટાઉન સ્ટ્રીટસ્કેપિંગ

પ્રાંતના ડાઉનટાઉન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામ સાથે સંપૂર્ણપણે સંકલન કરીને સિટી એવી સ્ટ્રીટસ્કેપિંગની પહેલો સાથે આગળ વધી રહ્યું છે જેમાં સામેલ છે હાલના કુટપાથને બદલીને સ્ટોન પેવરો નાખવા અને માર્ગોને રિસર્ફેસ કરવા તેમજ કિવન માર્ગ અને મેઈન સ્ટ્રીટની બન્ને બાજુના કુટપાથને પહોળા કરવા. આવું લગભગ \$16.6 મિલિયનનું રોકાણ વાણિજ્યિક પ્રવૃત્તિ, રાહદારીઓ અને સાર્થકલ સવારો માટે ઉચ્ચ ગુણવત્તા ધરાવતી શહેરી જગ્યાઓ ઊભી કરશે અને ઈટોબિકોક અને ફ્લેચર ક્રીક વચ્ચે સક્રિય જોડાણ ઊભા કરશે જેથી ડાઉનટાઉનના હાર્ટમાં એક ઉન્નત રાહદારી ક્ષેત્ર સર્જશે.

ડાઉનટાઉન બ્રેમ્પટન પ્રોજેક્ટ્સ સેંટર

[ડાઉનટાઉન બ્રેમ્પટન પ્રોજેક્ટ્સ સેંટર](#) (DBPC) હવે વર્ચ્યુઅલ માધ્યમ પર ખુલી ગયું છે. શહેરનો સ્ટાફ ડાઉનટાઉનના વ્યવસાયો અને રહેવાસીઓને સહાય કરવા અને ડાઉનટાઉનને પુનઃજીવિત કરવા માટે કાર્યક્રમો અને પહેલો પહોંચાડવાનું ચાલુ રાખવા માટે તૈયાર છે. પીલ રિજનનો સ્ટાફ પણ બાંધકામ દરમિયાન ઉપલબ્ધ રહેશે.

પરિયોજનાઓ જેને DBPCના માધ્યમથી સહાયતા મળશે તેમાં સામેલ છે રિજનની પાણીની મુખ્ય લાઈનો અને ગટરો બદલવાની પરિયોજના તેમજ [માય મેઈન સ્ટ્રીટ પ્રોગ્રામ \(My Main Street program\)](#). એક ડાઉનટાઉન સંયોજક સ્થાનિક વ્યવસાયોને, ડાઉનટાઉન બ્રેમ્પટન BIAને અને ચૂંટાયેલ સત્તાધિકારીઓને નાના પાયે થનાર પરિયોજનાઓને અમલ કરવામાં સહાય કરશે અને પ્રશ્નોને ઉચિત સિટીના વિભાગો તરફ વાળશે.

www.brampton.ca/downtownbrampton પર DBPC વિશે વધુ જાણકારી મેળવો.

સપોર્ટ લોકલ

બ્રેમ્પટનના ડાઉનટાઉન બિઝનેસ સમુદાયને COVID-19 મહામારીથી ભારે ફટકો પડ્યો છે, અને શહેર આવા વિક્ષેપો ઓછા કરવા અને તેમની આર્થિક રિકવરી ટેકો આપવા સમર્પિત છે જ્યારે લગભગ તે જાહેર સ્થળોને ઉન્નત કરવા માટે મહત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારામાં નિવેશ કરવાનું ચાલુ રાખે છે.

આ સમય દરમિયાન રહેવાસીઓને ડાઉનટાઉનના વ્યવસાયોની મુલાકાત લેતા રહેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. બ્રેમ્પટનના લઘુ વ્યવસાયોની સંપૂર્ણ યાદી તમને [સપોર્ટ લોકલ બ્રેમ્પટન વેબસાઈટ](#) પર મળી રહેશે.

બાંધકામ ચાલુ હોવાથી તમારા મનપસંદ વ્યવસાયોની મુલાકાત લેવા માટે ઉપલબ્ધ પાર્કિંગ વિકલ્પોની સંપૂર્ણ સૂચિ માટે મુલાકાત લો www.brampton.ca.

ઈન્ટિગ્રેટેડ ડાઉનટાઉન પ્લાન

ઈન્ટિગ્રેટેડ ડાઉનટાઉન પ્લાન (IDP) એટલે કાર્યવાહીનો રોડમેપ – ડાઉનટાઉન બ્રેમ્પટનના અનેક ચાલી રહેલા ઉપક્રમો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓનું સંકલન. અપેક્ષા રાખવામાં આવે છે કે તેનાથી ભાવિ વિકાસ અને વ્યુહાત્મક નિવેશને 2051 સુધી દિશાનિર્દેશો સાંપડશે.

IDPના માર્ગદર્શક સિદ્ધાંતો છે સમાવેશિતા, નવાચાર એટલેકે ઈનોવેશન અને સ્થિરતા. તેનાથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ, શહેરી ડીઝાઈન, જમીનનો ઉપયોગ અને પ્રોગ્રામિંગ હસ્તક્ષેપોને સંકલિત કરવામાં મદદ મળશે - જેથી બ્રેમ્પટન એક અગત્યનો આર્થિક ચાલક, પ્રાદેશિક સાંસ્કૃતિક કેન્દ્ર અને ઈનોવેશન ડિસ્ટ્રિક્ટ તરીકે ઉભરશે.

IDP પર વધુ માહિતી માટે અહીં મુલાકાત લો www.brampton.ca/IDP.

સુવાક્યો

"અમારા ભાગીદારો સાથે મળી અમે ડાઉનટાઉન બ્રેમ્પટનની સંભાવનાઓને પુનઃજીવીત કરવા અને ખુલ્લી પાડવા કાર્ય કરી રહ્યા છીએ જેનાથી એક ગુણવત્તાસભર શહેરી જગ્યાનું સર્જન થશે અને આપણા ડાઉનટાઉનના હાર્દમાં રાહદારીઓ માટેની ઉન્નત સુધ્ધી ઊભી થશે. ટૂંકા ગાળાના બાંધકામમાં વિક્ષેપ આવી શકે છે પણ છેવટે તો આ પરિયોજનાઓથી બ્રેમ્પટન એક આર્થિક આગેવાન, પ્રાદેશિક સાંસ્કૃતિક કેન્દ્ર અને ઈનોવેશનના વૈશ્વિક આગેવાન હોવાની પોતાની છાપને ઉભરાવી શકશે. અમે અમારા રહેવાસીઓ અને વ્યવસાયોની ધીરજની કદર કરીએ છીએ અને આ કામ જ્યારે થઈ રહ્યું હશે ત્યારે સપોર્ટ લોકલ બ્રેમ્પટનને ટેકો આપવા બદલ આપણા સમુદાયનો આભાર માનીએ છીએ.

- પૅટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

"ડાઉનટાઉન બ્રેમ્પટન એક રોમાંચક પરિવર્તનના દોરમાંથી પસાર થઈ રહ્યું છે. પ્રદેશ દ્વારા બાંધકામનું આ પ્રથમ પગલું આપણા ડાઉનટાઉનના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુખાકારી માટે આવશ્યક છે અને તે આપણા શહેરના હાર્દને વિકસાવવા માટેના સ્ટ્રીટસ્કેપિંગ અને અન્ય પહેલો આપણે ચાલુ રાખી શકીએ તે માટેનો પાયો નાખશે. યોજનાબદ્ધ ડાઉનટાઉન કાર્યથી અમારા ડાઉનટાઉન, રહેવાસીઓ અને સ્થાનિક વ્યવસાયોને જે લાભ મળશે તે જોવા અમે ઉત્સુક છીએ."

પૉલ વિસેન્ટ, રીજનલ કાઉન્સિલર, વૉર્ડ 1 અને 5; પબ્લિક વર્ક્સ એન્ડ એન્જિનિયરિંગ, સિટી ઓફ બ્રેમ્પટનના પ્રમુખ

"અમારા ડાઉનટાઉન વ્યવસાયોને COVID-19 મહામારી અને ચાલુ રહેલ બંધને કારણે મોટો ફટકો પડ્યો છે અને અમે તેમના આર્થિક પુનરુત્થાનના પ્રવાસમાં તેમને મદદરૂપ થવા સમર્પિત છીએ. આપણા વ્યવસાયો પર બાંધકામની અસરને ઘટાડવા માટે, આપણે જ્યારે ડાઉનટાઉનને નવજીવન આપી રહ્યા છીએ ત્યારે હું આપણા રહેવાસીઓને ખરીદી કરવા, બહાર ખાવા અને સ્થાનિક વ્યવસાયોની મુલાકાત લેતા રહેવા પ્રોત્સાહિત કરું છું. એકસાથે હાથ ધરવામાં આવતી આપણી ઘણી ડાઉનટાઉનની પહેલો સાથે રિજનનું કાર્ય કરતા રહેવાથી, બધાને લાભ લેવા અને માણવા માટેના એક ગતિશીલ અને સ્થિતિસ્થાપક ડાઉનટાઉન બનાવવામાં મદદ કરશે.

- માર્ટિન મેડિરોસ (Martin Medeiros), રીજનલ કાઉન્સિલર, વૉર્ડ 3 & 4, પ્રમુખ, ઈકોનોમિક ડેવેલપમેન્ટ એન્ડ કલ્ચર: સીટી ઓફ બ્રેમ્પટન.

"સિટી ખાતે અમે આપના ડાઉનટાઉનના ઉન્નતીકરણ માટે અને આપણા રહેવાસીઓ સારી રીતે રહી શકે, કામ કરી શકે અને આનંદમાં કરી શકે તે માટે પ્રતિબદ્ધ છીએ. આપણા જાહેર સ્થળોમાં સુધારો લાવીને અમે રોજગાર ઊભો કરીશું, આર્થિક રિકવરીનું સમર્થન કરીશું અને અમારા રહેવાસીઓની જીવન ગુણવત્તામાં સુધારો લાવી શકીશું. અમે આ આવશ્યક અને રોમાંચક કાર્યને પૂર્ણ કરવા માટે પ્રદેશ સાથે કામ કરવા આતુર છીએ."

- ડેવિડ બારિક, ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સિટી ઓફ બ્રેમ્પટન

સિટી ઓફ બ્રેમ્પટનમાં અમારા ભાગીદારો સાથે મળીને, અમે અમારા ડાઉનટાઉનના વ્યવસાયોના ચાલુ રહેલ પુનરુત્થાનને સમર્થન આપવા કટિબદ્ધ છીએ જ્યારે અમે આપણા શહેરના હાર્દના જાહેર સ્થળોને ઉન્નત કરીએ છીએ. હું નિવાસીઓને યાદ અપાવું છું કે આ સુધારા થઈ રહ્યા છે ત્યારે આપણી સ્થાનિક દુકાનો, રેસ્ટોરન્ટો અને સેવાઓ ચાલુ જ રહેશે! અમે વાકેફ છીએ કે આ રોમાંચક પરિવર્તનની પ્રતિક્ષા લેખે લાગશે."

- સુઝી ગોડફ્રોય, એગ્રિક્યુલ્ચરલ ડિરેક્ટર, ડાઉનટાઉન બ્રેમ્પટન ક્ષેત્ર (BIA)

"ડાઉનટાઉન બ્રેમ્પટન BIA વતી અમે રોમાંચિત છીએ કે આખા ક્ષેત્રમાં પરિવર્તન થઈ રહ્યું છે અને અમે તે જોવા આતુર છીએ કે તેનાથી આપણા સ્થાનિક વ્યવસાયો અને બ્રેમ્પટનવાસીઓને કેટકેટલા લાભ થશે. આપણે જ્યારે COVID-19 મહામારીના પ્રભાવમાંથી આગળ વધી રહ્યા છીએ ત્યારે અમે આપણા સમુદાયને વિનંતી કરીએ કે બાંધકામ ચાલુ હોય ત્યારે પણ તેઓ જરૂરથી ખરીદી કરે, બહાર ભોજન લે અને સ્થાનિક વ્યવસાયોને અજમાવે. ડાઉનટાઉનમાં પુષ્કળ પ્રમાણમાં સુગમ પાર્કિંગ કરવાના વિકલ્પો છે જે સિટીની વેબસાઈટ પર મળી જશે અને સાથે આપણા વ્યવસાયો ચાલુ રહેશે અને તમારી સેવા માટે તત્પર રહેશે!"

- કેરી પરસિવલ, પ્રમુખ, ડાઉનટાઉન બ્રેમ્પટન બિઝનેસ ઈમ્પ્રૂવમેન્ટ એરિયા (BIA)

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca

મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

સીટી ઓફ બ્રેમ્પટન મલ્ટિકલ્ચરલ મિડિયા

multiculturalmedia@brampton.ca